

**NALIN[®] LEASE FINANCE LIMITED**

CIN : L65910GJ1990PLC014516

Date: 14th February, 2024

To,
BSE Ltd.
Phiroze Jeejeebhoy Towers
25th Floor,
Dalal Street Mumbai-400 001
Company Code 531212

Subject: Publication of Unaudited Financial Results for the quarter and nine months ended on 31st December, 2023 -reg.

Dear Sir(s),

Pursuant to Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we inform you that the Unaudited Financial Results for the quarter and nine months ended on 31st December, 2023 of the Company has been published in Western Times (English and Gujarati language) newspapers on Wednesday, 14th February, 2024.

Copies of the said publication are enclosed for your reference.

Kindly take the same on record and acknowledge the receipt of the same.

Thanking you,

Yours faithfully,

For Nalin Lease Finance Limited,

Nikul Patel
Chief Financial Officer



Enclosure: As above

NSDC launches Centre for Future Skills to skill youth in new-age technologies

New Delhi, February 12, 2024: To impart outcome-driven and high-quality skill training to the youth and to make them catalysts in achieving the vision of Viksit Bharat by 2047, National Skill Development Corporation (NSDC) in collaboration with Ethnotech Academic Solutions Pvt Ltd, Bengaluru, launched the Centre for Future Skills in Kalaburagi, Karnataka – a visionary platform that elevates the capabilities of the youth in future skills.

Shri. Subhas Sarkar, Hon'ble Minister of State for Higher Education, Government of India and Shri. Umesh Jadhav, Hon'ble Member of Parliament were the Chief Guest for the event. Shri. Ved Mani Tiwari, CEO, NSDC and

MD, NSDC International; Dr. Pratapsinh Desai, President, Indian Society for Technical Information (ISTE); Dr. Kiran K Rajanna, Chairman, Ethnotech Group of Companies; Dr. Bhimashankar C Bilgundi, President, HKE Society, Kalaburagi; R. Velraj, Vice Chancellor, Anna University, Chennai; Prof. (Dr) Buta Singh Sidhu, Vice Chancellor, Maharaja Ranjitsingh Punjab Technical University, Bathinda; and Dr. S.N. Singh, Director, Indian Institute of Information Technology and Management, Gwalior also addressed the event.

By combining traditional education with new-age learning, the envisioned platform bridges the skill gap and enhances internship and employability

prospects in alignment with the National Education Policy (NEP) 2020.

Shri. Subhas Sarkar, Hon'ble Minister of State for Higher Education, Government of India said, "The inauguration of the NSDC's Centre for Future Skills marks a significant stride in advancing skill development and education in our nation. Speaking on the launch, Ved Mani Tiwari, CEO, NSDC and MD NSDC International said, "The rapid pace of technological advancement, characterised by automation, artificial intelligence, data analytics, and the Internet of Things, is fundamentally transforming industries and job roles. The escalating demand for skills necessitates the equipping youth with capabilities and knowledge in emerging technologies like AI, ML, and Robotics that caters to evolving needs of the industry that seamlessly aligns with the vision of Hon'ble Prime Minister of making India 'Viksit Bharat' by 2047.

OmniScience Capital Pioneers Ayodhya Investment Strategy for Smallcase Platform

Mumbai, OmniScience Capital, a leading global investment management firm specializing in global and Indian equity investments, proudly announces the launch of its revolutionary investment strategy - the OmniAyodhya UP (Uttar Pradesh) Strategy. This pioneering approach, accessible on the popular smallcase platform, leverages the potential of diverse sectors aligned with the growth of Uttar Pradesh region, propelling it towards a Trillion Dollar Economy. The strategy, unveiled on January 22, 2024, is available to investors on the smallcase platform starting February 1, 2024, coinciding with OmniScience Capital's 7th Founding Day.

Dr. Vikas Gupta, CEO & Chief Investment Strategist at OmniScience Capital, expressed excitement about this new growth vector, highlighting its well-diversified nature and robust economic rationale grounded in the Sci-

entific Investing Framework.

"The strategy aims to catalyze exponential economic development in Uttar Pradesh, focusing on the redevelopment of Ayodhya as outlined in the Government Master Plan 2031. With an investment exceeding INR 85,000 crore (~\$10 Billion), this initiative aims to enhance the infrastructure of the holy city. Already, 20,000 jobs have been created even before the Pran Pratishtha event of the Sri Ram Temple. Ultimately, more than 150,000 permanent jobs are expected to be created, contributing to the goal of making UP a Trillion Dollar Economy.

The investment is anticipated to benefit stocks related to Connectivity, Roads & Infrastructure Companies, Electric Vehicles, Hotels, Loans & Payments Banks (Credit cards and UPI), and Telecom sectors," said Dr. Gupta.

Dr Gupta emphasized

"Invest for Ayodhya, Stay for Development, and Gain from UP. However, Investors should be careful not to pick stocks based on faith or emotions but rather focus on stocks with strong financial resources, growth opportunities and which are available at a discount to intrinsic value," he said Mr. Ashwini Shami, Executive Vice President & Portfolio Manager at OmniScience Capital, highlighted the firm's forward-thinking approach to identify and capitalize on emerging growth vectors.

Small and mid-cap stocks driven up by speculative buying correcting, say analysts

New Delhi, Feb 13 (IANS) An important ongoing trend in the market is the weakness in the broader market with sharp cuts in many mid and small-caps, says V.K. Vijayakumar, Chief Investment Strategist, Geojit Financial Services. Many such stocks driven up by speculative buying without consideration for the fundamentals are correcting. This trend is likely to continue since many such stocks are excessively valued, he said. The explosive growth in the number of demat accounts and the newbies chasing mid and small-caps influenced by recency bias have contributed to this froth in the broader market.

PUBLIC NOTICE

NOTICE is hereby given that we are investigating the title of Takshashila Rescom Private Limited ("Owner") in relation to its right, title, interest and share in respect of all those office premises (proposed to be constructed) at Village Chhadavad, Taluka Sabarmati, District Ahmedabad as more particularly mentioned against their names in the Schedule hereunder written (collectively "the Property"), including the right and entitlement of the Owner to create a mortgage in favour of our client in respect of the Property for securing certain loans/financial facilities proposed to be extended by our client to the Owner ("the Proposed Transaction").

All persons having any claim and/or demand against / upon / in or to or upon the Property, by way of inheritance, mortgage (equitable or otherwise), sale, agreement for sale, grant of development rights, transfer, assignment, lease, sub-lease, license, share, lien charge, trust, inheritance, maintenance, easement, right of way, gift, acquisition, partition, requisition, any encumbrance or beneficial right / interest under any trust, right of prescription or pre-emption or under any agreement or memorandum of understanding or other disposition or under any suit, decree, injunction order or attachment or award passed by any Court or Authority (including, lis-pendens, decree or order of any adjudicating authority, exchange, partition, power of attorney, will, bequest, FSI, tenancy, development rights, family arrangement) settlement, possession, allotment or otherwise whatsoever ("Claim") or otherwise having any objection to the Proposed Transaction ("Objection"), is hereby requested to make the same known in writing together with copies of supporting documentary evidence to the undersigned at SBS LEGAL, Advocates at 1206, 12th Floor, "West Wing", VENUS STRATUM, Nehrunagar, Satellite Road, Ahmedabad -380015 and by email addressed to siddharth@sbslegal.in, within 10 (ten) days from the date hereof, failing which, it shall be presumed that no such Claim exists or that such Claim, if any, will be considered to have been waived and/or abandoned and the same shall be treated as not binding on our client and our client shall thereupon proceed to culminate the Proposed Transaction notwithstanding any Claim or Objection.

SCHEDULE

All those office premises in the building to be known as MAXIMA forming part of scheme known as MORE TOWERS proposed to be constructed on land acquisition in aggregate 6820.33 square meters approximately and comprised in the site lying and being at Village Chhadavad, Taluka Sabarmati, District Ahmedabad bearing Final Plot No. 560B and 560 A+B as described below:

Sr No	Flat No	Admeasuring (sq feet)	Terrace area (sq feet)	Parking No.
1.	801	776		1 81 (-1)
2.	802	1761	103	1 82 (-1)
3.	803	1062	61	1 83 (-1)
4.	804	967	61	1 84 (-1)
5.	805	875	61	1 85 (-1)
6.	806	979	61	1 86 (-1)
7.	807	881	59	1 87 (-1)
8.	808	770	59	1 88 (-1)
9.	809	923	59	1 89 (-1)
10.	810	822	59	1 90 (-1)
11.	811	744	60	1 91 (-1)
12.	812	668	59	1 92 (-1)
13.	813	1504	218	1 93 (-1)
14.	814	1149		1 94 (-1)
15.	815	761		1 95 (-1)
16.	816	757		1 96 (-1)
17.	817	1016		1 97 (-1)
18.	818	938		1 98 (-1)
19.	819	928		1 99 (-1)
20.	820	980		1 100 (-1)
21.	821	754		1 101 (-1)

Dated this 14 day of February 2024.

For SBS LEGAL,
Sd/-
Siddharth Singh
Advocate
at 1206, 12th Floor, "West Wing", VENUS STRATUM, Nehrunagar, Satellite Road, Ahmedabad -380015

WESTERN RAILWAY-AHMEDABAD DIVISION E-AUCTION FOR NON FARE REVENUE CONTRACTS

Sr. Divisional Commercial Manager's Office, Amdapura, Naroda Road, Ahmedabad-382345 Western Railway, Ahmedabad Division Email: tendercell@wrr.adi@gmail.com Bids are invited on E-auction for Non Fare Revenue contracts of Ahmedabad Division for following categories which have been already published on IREPS website. The details are furnished as under:-

Catalogue No	Type of Contract	Category	Date & Time of E-Auction
NFR-ADI-43-23	Advertising-Train Interior	Advertisement	E-Auction for all lots will start at 12:00 hours on 26.02.2024
	Advertising-Train Exterior	Advertisement	
	ATM	ATM	
	Two wheeler and other parcel packing services	Misc-Static-Services	

Note: (1) Prospective Bidders are requested to visit the e-Auction Leasing module on IREPS website (www.ireps.gov.in) and get themselves registered before participating in the auction. (2) The Lot-wise details under above mentioned Catalogue No. are available under the head of the upcoming e-auction. Zone: Western Railway, Unit: Ahmedabad Division-Commercial. (3) Initial Cooling Off period is 30 minutes. Successive Lot Closing interval is 10 minutes. Lot-wise Closing Time can be viewed in the e-Auction module of IREPS. (4) For any queries related to scheduled auction, please reach us at srdcm@adi.railnet.gov.in or on +91-9724093968.

MERCHANT CHARITABLE TRUST, BASNA, VISNAGAR Merchant Education Campus, Mehana Visnagar Highway, Basna Mehana 384001

Applications are invited for the following post at Merchant Engineering College (MEC) and Merchant Institute of Diploma Studies (MIDS) on or before 29/02/2024 by RPAD along with Bio-data and all self-attested testimonials with two passport size photo.

Sr. No.	Discipline	MEC (UG/PG)			MIDS (Diploma)	HOD	Lecturer
		Prof.	Asso. Prof.	Asst. Prof.			
1	Automobile Engineering	00	03	04	-	-	
2	Civil Engineering	00	03	05	01	03	
3	Computer Engineering	00	03	06	01	03	
4	Electrical Engineering	00	03	05	01	04	
5	E & C Engineering	00	01	04	01	01	
6	Mechanical Engineering	01	06	05	01	03	
7	Mathematics	00	00	02	-	-	
8	Physics	00	00	01	-	-	
9	English	00	00	01	-	-	

- Eligibility and Salary as per AICTE / GTU Norms.
 - Separate Application are invited for MEC and MIDS Colleges. Also mention the name of college & discipline on envelope without fail.
 - The Number of posts may vary at the time of interview.
- CHAIRMAN

Electronics and Quality Development Centre QUOTATION NOTICE

EDQC, Gandhinagar invites Quotation from interested sellers for the following items. Detail specification are available on EDQC web portal www.edqc.in and can be downloaded up to 29/02/2024. Interested sellers can send their Quotation/offers to below mentioned address in seal cover/envelop.

Date: 12/02/2024

Sr. No.	Description
1	High Resistance Meter for Insulation Resistance Test as per IS 10810-43
2	Halogen Acid Gas Evaluation Apparatus for Test of Halogen Acid Gas Evaluation as per IS 10810-59
3	Smoke density test apparatus as per IS 694: 2010
4	Hydraulic Hot Plate for preparing sample for Tensile, Oxygen & Temperature index, smoke density tests
5	Test apparatus for Persulphate Test as per IS 10810-4 (for tinned copper conductor only)
6	Oven for Loss of mass test as per IS 10810-10; Shrinkage Test as per IS 10810-12; Heat Shock Test as per IS 10810-14; for Bleeding and blooming test as IS 10810-19
7	Ageing Oven for Test-Ageing in Air Oven as per IS 10810-11
8	Test Apparatus & Freezer for Cold Bend Test as per IS 10810-20 & for Cold Impact Test as per IS 10810-21
9	Flex Test Apparatus for Flex Test as per IS 694 Table 1
10	Vacuum Oven for Water absorption test (Gravimetric) as per IS 10810-33
11	Infrared Thermometer Calibration system (300 °C to 1200 °C)

The Director, EDQC (Under STOC program, DEIT, MeitY, Govt. of India) (Govt. of Gujarat Establishment) B-177/178, GIDC Electronics Estate, Sector-25, Gandhinagar (Gujarat)-382024 Contact: 90990 15250, Email: md@edqc.in, adg@edqc.in web: www.edqc.in INF/2454/23-24

Gujarat Petroleum, Chemicals & Petrochemicals Special Investment Regional Development Authority

(A Govt. of Gujarat Undertaking)
Block No.11-12, 3rd Floor, Udyog Bhavan, gh-4, sector-11, Gandhinagar-382011 Tel.No.079-23241018, Fax No.079-23241019 Email ID- gpcpsir@gujarat.gov.in
Request for Proposal

Gujarat Petroleum, Chemicals & Petrochemicals Special Investment Regional Development Authority (GPCPSIRDA) invites bids for empanelment of consultants/Agencies for survey work. Detailed RFP document is available on www.gujaratpcpir.org

Sr.No.	Description of Work	Last date of submission
1	Empanelment of consultants/Agencies for survey work	23/02/2024 18.00 hrs

The proposals must be submitted in sealed envelope to the Member Secretary, GPCPSIRDA, Block no.11-12, 3rd floor, Udyog Bhavan, gh-4, sector-11, Gandhinagar-382011. Proposals shall not be accepted after last date of submission. For more details please visit www.gujaratpcpir.org

No:RDA/RFP/Survey Agency/2024/22 Sd/- Member Secretary GPCPSIRDA
Date: 12/02/2024 INF/2452/23-24

BISIL PLAST LIMITED

[CIN: L17119GJ1986PLC009009]
Registered Office: 406, Silver Oaks Commercial Complex, Opp. Arun Society, Paldi, Ahmedabad 380 007

EXTRACT OF STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31ST DECEMBER, 2023

Particulars	(Rs. In lakh)		
	Quarter ended on 31-12-2023 (Unaudited)	9 Months ended on 31-12-2023 (Cumulative) (Unaudited)	Quarter ended on 31-12-2022 (Unaudited)
Total income from operations (Net)	102.00	262.85	186.92
Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	8.21	16.59	15.18
Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	8.21	16.59	15.18
Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	8.21	16.59	15.18
Total Comprehensive Income for the period	8.21	16.59	15.18
Equity Share Capital	540.31	540.31	540.31
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year			
Earnings Per Share (after extraordinary items) (Face value of Rs. 1/- each) (for continuing and discontinued operations)			
Basic:	0.015	0.031	0.028
Diluted:	0.015	0.031	0.028

NOTES:
1 The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (LODR) Reg., 2015.
2 The full format of Quarterly Financial Results are available on the website of BSE Limited at www.bseindia.com and also on the website of the Company.

For BISIL PLAST LIMITED
SUKETU N. VAYWALA
CHAIRMAN
Date : 13th February, 2024
Place : Ahmedabad
DIN: 07619796

AMRAPALI INDUSTRIES LIMITED

Regd. Office: - Unit No. P05-02D, 5th Floor Tower A WTC Gift City Gandhinagar-382355. CIN :L91110GJ1988PLC010674 Phone : +926581329/30 Fax : +91 79 26579169
E-mail: ail@amrapali.com Website: www.amrapalispot.com.

STATEMENT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE THIRD QUARTER AND NINE MONTHS ENDED ON 31ST DECEMBER, 2023

PARTICULARS	STANDALONE					CONSOLIDATED						
	Quarter Ended		Nine Months Ended		Year ended	Quarter Ended		Nine Months Ended		Year ended		
	31/12/2023 (Unaudited)	30/09/2023 (Unaudited)	31/12/2022 (Unaudited)	31/12/2022 (Unaudited)	31/03/2023 (Unaudited)	31/12/2023 (Unaudited)	30/09/2023 (Unaudited)	31/12/2022 (Unaudited)	31/12/2022 (Unaudited)	31/03/2023 (Unaudited)		
Total Income from Operations	8,46,144.97	6,96,556.84	5,12,250.63	2,215,776.48	2,542,942.79	29,07,261.27	846,144.97	6,96,556.84	5,12,250.63	2,215,776.48	2,542,942.79	29,07,261.27
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	21.12	20.10	33.12	66.36	107.37	88.48	21.12	20.10	33.12	66.36	107.37	88.48
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	21.12	20.10	33.12	66.36	107.37	88.48	21.12	20.10	33.12	66.36	107.37	88.48
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	16.30	30.31	24.50	64.86	90.15	72.27	16.30	30.31	24.50	64.86	90.15	72.27
Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	16.30	30.31	24.50	64.86	90.15	72.27	16.30	30.31	24.50	64.86	90.15	72.27
Equity Share Capital	2570.53	2570.53	2570.53	2570.53	2570.53	2570.53	2570.53	2570.53	2570.53	2570.53	2570.53	2570.53
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	---	---	---	---	---	---	---	---	---	---	---	---
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)												
Basic & Diluted:	0.03	0.06	0.05	0.13	0.18	0.14	0.03	0.06	0.05	0.13	0.18	0.14

NOTES:
The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the stock exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter/Annual Financial Results are available on the stock exchange websites at www.bseindia.com, www.nseindia.com and on company's website www.ausom.in.

For AMRAPALI INDUSTRIES LIMITED
Sd/-
YASHWANT THAKKAR
MANAGING DIRECTOR
Date : 13/02/2024
Place : AHMEDABAD
DIN : 00071126

WESTERN RAILWAY - VADODARA DIVISION

OPEN 'E' TENDER NOTICE

Tender No. EL/TRD/Tender/23-24/29, Tenders for and on behalf of The President of India are invited by Divisional Railway Manager (Electrical Tr.D) Western Railway, Pratapnagar, Vadodara - 390 004 for the following works. Sr. No.1 - Tender No. & Name of Work: EL/TRD/Tender/23-24/29, Identification of defect and hotspot of 25kV AC Traction Installation using Thermo Vision Camera in Surat-Vadodara - Geratpur and Vadodara-Godhra section for a period of two years in Vadodara division. Approximate cost of the work: ₹ 24.71,520/- Bid security: ₹ 49,400/- Cost of Tender documents and completion period: Completion period 24 months. Tender scheduled on: Tender closing date 11.03.2024 and time of closing at 15:00 hrs. on the same date. Web page particulars and notice for location where complete details can be seen & address of the office and clarification: Web site @ www.ireps.gov.in Divisional Railway Manager (Electrical Tr.D) Western Railway, Pratapnagar, Vadodara - 390 004 (EL/TRD/Tender/23-24/29 dtd. 08/02/2024) 330

Like us on: [Facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly)

KUSH INDUSTRIES LIMITED

(Formerly known as SNS Textiles Limited)
[CIN: L74110GJ1992PLC017218]
Registered Office : Plot No.129, Near J. B. Chemicals, G.I.D.C. Estate, Ankleshwar - 393 002, Dist. - Bharuch, (Gujarat)

EXTRACT OF STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31ST DECEMBER, 2023

PARTICULARS	(Rs. In Lakh)		
	Quarter ended on 31-12-2023 (Unaudited)	9 Months ended on 31-12-2023 (Cumulative) (Unaudited)	Quarter ended on 31-12-2022 (Unaudited)
Total income from operations (Net)	0.44	66.32	0.48
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(1.42)	(2.81)	(3.00)
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	229.98	228.59	(3.00)
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	229.98	228.59	(3.00)
Total Comprehensive Income for the period	230.40	230.29	(2.76)
Equity Share Capital	1484.68	1484.68	1484.68
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year			
Earnings Per Share (after extraordinary items) (Face value of Rs. 10/- each) (for continuing and discontinued operations)			
Basic:	1.51	1.51	(0.002)
Diluted:	1.51	1.51	(0.002)

NOTES:
1 The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (LODR) Reg., 2015.
2 The full format of Quarterly Financial Results are available on the website of BSE Limited at www.bseindia.com and also on the website of the Company.

For KUSH INDUSTRIES LIMITED
MANSUKH K. VIRANI
WHOLE TIME DIRECTOR
(DIN: 00873403)
Date : 13th February, 2024
Place : Ankleshwar

NALIN LEASE FINANCE LIMITED

CIN: L65910GJ1990PLC014516
Regd.Off: Ground Floor, Gandhi Nursing Home Bldg., Dr.Nalinkant Gandhi Road, Himatnagar-383 001.Gujarat India Phone: 02772-241264, 242264, email : info@nalinfin.co.in, www.nalinfin.co.in

EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31.12.2023

Sl. No.	PARTICULARS	(Rs.in Lacs)			
		For the quarter ended		For the year ended	
		31 Dec 2023	30 Sep 2023	31 Dec 2022	31 March 2023
		Unaudited	Unaudited	Unaudited	Audited
1.	Total Income From Operations	184.24	168.42	152.99	576.31
2.	Net Profit/(loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	155.44	141.61	117.79	399.72
3.	Net Profit/(loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	155.44	141.61	117.79	399.72
4.	Net Profit/(loss) for the period after Tax(after Exceptional and/or Extraordinary items)	108.08	103.46	87.98	299.26
5.	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after tax)	108.08	103.46	87.98	299.26
6.	Paid up Equity Share Capital	655.82	655.82	655.82	655.82
8.	Earnings Per share (of Rs 10/- each) (for continuing and discontinuing operations)-				
1.	Basic:	1.65	1.5		

